

## ઓબાધા

અદોમ સજા પામશે

1 આ ઓબાધાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે:

યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે.

દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે.  
ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઢીએ.”

યહોવા અદોમને કહે છે

2 “હું તને રાષ્ટ્રો વચ્ચે સૌથી નાનું બનાવીશ.

તું અતિશય ઘૃણિત છે.

3 ઓ ઊંચા પહાડો પર

અને ખડકોની બખીલમાં વસનાર,

તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે.

તું તારા મનમાં એમ વિચારે છે કે,

‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?’ ”

અદોમને નીચું પાડવામાં આવશે

4 “ગરૂડની જેમ તું ઘણે ઊંચે ચઢીશ

અને તારાઓ મધ્યે તારો માળો બાંધીશ તો,

ત્યાંથીય હું તને નીચે પાડીશ એમ યહોવા કહે છે.

5 જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત.

ઘાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત.

તેઓએ ફક્ત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત.

જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત.

તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત,

પણ તારો સંપૂર્ણ નાશ થશે.

6 એસાવનો દેશ કેવો લૂંટાઈ ગયો!

- તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!  
 7 તારી સાથે મૈત્રી કરાર કર્યો છે,  
 તેઓ તને સરહદ બહાર કાઢી મુકશે.  
 તેઓ તને છેતરશે.  
 તારા બધા મિત્રો તને હરાવશે.  
 તેઓ તારો રોટલો તારી નીચે  
 જાળની જેમ રાખે છે.  
 ‘તને તેની સમજ નહિ હોય.’ ”
- 8 યહોવા કહે છે, “તે દિવસે આખા અદોમમાં એક  
 પણ શાણો માણસ હશે નહિ કારણકે  
 હું એસાવ પર્વત પરના સર્વ શાણા માણસોનું શાણપણ હરી  
 લઈશ.
- 9 હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે  
 અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યક્તિનો નાશ  
 અને સંહાર કરવામાં આવશે.
- 10 હે અદોમ, તારા ભાઈ યાકૂબ પર  
 થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઈ જઈશ  
 અને તારો સદાને માટે નાશ થશે.
- 11 જે દિવસે દુશ્મન પરદેશીઓ  
 યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા  
 અને તેની સંપત્તિ કબજે કરી  
 અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા,  
 તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.
- 12 પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઈ જવાયો હતો  
 ત્યારે તારે ખુશ થવું જોઈતું ન હતું,  
 યહૂદાના નાશના દિવસે  
 તારે આનંદ માણવો જોઈતો ન હતો,  
 જ્યારે તેઓ પિડીત હતા,  
 ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઈતી ન હતી.
- 13 તારે મારા લોકોની આપત્તિને દિવસે એમના શહેરનાં  
 દરવાજામાં દાખલ થવું જોઈતું નહોતું.

તેમની મુશ્કેલીના સમયે તારે તેમની વિપત્તિ વિષે ખુશ થવું જોઇતું  
ન હતું.

તેમની મુશ્કેલીના સમયે તારે તેમની સંપત્તિ લુંટવી જોઇતી ન  
હતી.

14 તારે તારા ભાગી જતા ભાઈઓની હુત્યા કરવા  
રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું.  
મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા  
જોઇતા ન હતાં.

15 યહોવા ટૂંક સમયમાં જ  
સર્વ રાષ્ટ્રો પર વેર લેશે.  
તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે.  
તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.

16 જેમ તેં મારા પવિત્ર પર્વત પર પીધું,  
તેથી બધાં રાષ્ટ્રો પણ સતત પીશે અને ગળશે,  
જ્યાં સુધી તેમનું અસ્તિત્વ  
સમાપ્ત થાય ત્યાં સુધી.

17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે,  
અને તે પવિત્ર થશે,  
યાફૂબના વંશજો પોતાનો  
વારસો પાછો મેળવશે.

18 યાફૂબનું કુટુંબ અગ્નિ જેવું  
અને યૂસફનું કુટુંબ જવાળા જેવું બનશે.  
તેઓ એસાવના વંશજોને  
સૂકા ખેતરની જેમ સળગાવી અનેનષ્ટ કરશે.  
કોઈ પણ અદોમથી પલાયન થશે નહિ.”  
કારણકે યહોવાએ તેમ કહ્યું છે.

19 દક્ષિણ યહૂદાના લોકો એસાવના પર્વતનો કબજો લેશે;  
પશ્ચિમની તળેટીના લોકો પલિસ્તીયોનો કબજો લેશે;  
તેઓ એફ્રાઇમના અને સમરૂનના પ્રદેશનો પણ કબજો લેશે.  
બિન્યામીનના લોકો ગિલયાદનો કબજો લેશે.

20 ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે.

કનાનથી સારકૃત સુધીના લોકો વચ્ચે,  
 અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે,  
 તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.

21 ઉધ્ધારકો સિયોન પર્વત પર જશે  
 અને એસાવના પર્વતનો ન્યાય કરશે  
 અને યહોવા પોતે રાજા બનશે.

## પવિત્ર બાઇબલ

### **The Holy Bible in Gujarati, Easy Reading Version**

copyright © 1997-2009 World Bible Translation Center

Language: ગુજરાતી (Gujarati)

Translation by: World Bible Translation Center

License Agreement for Bible Texts World Bible Translation Center  
 Last Updated: September 21, 2006 Copyright © 2006 by World Bible Translation Center All rights reserved. These Scriptures: □ Are copyrighted by World Bible Translation Center. □ Are not public domain. □ May not be altered or modified in any form. □ May not be sold or offered for sale in any form. □ May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used for the purpose of selling online ad space). □ May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be hosted on any kind of server (including a Web or ftp server) without written permission. A copy of this license (without modification) must also be included. □ May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which it is quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: “Taken from the HOLY BIBLE: EASY-TO-READ VERSION™ © 2006 by World Bible Translation Center, Inc. and used by permission.” If the text quoted is from one of WBTC’s non-English versions, the printed title of the actual text quoted will be substituted for “HOLY BIBLE: EASY-TO-READ VERSION™.” The copyright notice must appear in English or be translated into another language. When quotations from WBTC’s text are used in non-saleable media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright notice is not required, but the initials of the version (such as “ERV” for the Easy-to-Read Version™ in English) must appear at the end of each quotation. Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for usage, such as the use of WBTC’s text on a Web site, or for clarification of any of the above, please contact World Bible Translation Center in writing or by email at [distribution@wbtc.com](mailto:distribution@wbtc.com). World Bible Translation Center P.O. Box 820648 Fort Worth, Texas 76182, USA Telephone: 1-817-595-1664 Toll-

Free in US: 1-888-54-BIBLE E-mail: [info@wbtc.com](mailto:info@wbtc.com) WBTC's web site –  
World Bible Translation Center's web site: <http://www.wbtc.org>

2013-11-04

---

PDF generated using Haiola and XeLaTeX on 18 Apr 2025 from source  
files dated 31 Aug 2023

e7105d68-9195-5020-a313-7baf29791a07